

મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભુજ અને નોર્થ અમેરિકાથી પ્રકાશિત

# દિવ્ય ભાસ્કર

■ મહાનગર ■ વર્ષ ૫ ■ અંક ૨૫ ■ શ્રાવણ વદ ૧૨ વિક્રમ સંવત ૨૦૬૪ ■ મુંબઈ ■ ગુરુવાર, ૨૮ ઓગસ્ટ ૨૦૦૮ ■ કિંમત ૩.૦૦ રૂપિયા ■ પાના ૧૪

## ૨૬૦ કિલોના સુલેમાનનું વજન શસ્ત્રક્રિયાથી ૧૦૦ કિલો ઘટ્યું

સાહસકર ન્યૂઝ | મુંબઈ

તમારું વજન ૨૬૦ કિલોથી વધુ હશે તો તમે શું કરશો? તમે તમારા પોટાપાને કાઢશે પાંચ વર્ષથી ઘરની બહાર નથી નીકળ્યા તો શું કરશો? જો વધુ વજનથી તમને ડાયાબિટીસ, હૃદયરોગનો ખુમલો ધરે તો તમે શું કરશો? સુલેમાન ચિરાણીએ આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે બેરિઆટ્રીક સર્જરીનો આશરો લીધો હતો. તેણે બેપરોસ્કોપિક સ્લીવ ગેસ્ટ્રેક્ટોમીનું ઓપરેશન કરાવ્યું હતું. આ સર્જરી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે કરાઈ હતી.

જાડિયાપણા વિષે બોલતાં વોકહાર્ટ હોસ્પિટલના

એસોસિયેટેડ વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. રવીન્દ્ર કરંજેકરે જણાવ્યું હતું કે આપણા દેશમાં જાડિયાપણું એ મૃત્યુ માટેનું એક મુખ્ય કારણ છે.

કારણ કે તેનાથી ડાયાબિટીસ, હાર્ટપર ટેન્શન, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને સંધિવા જેવા રોગોનો જન્મ થાય છે. આ સમસ્યાનો અંત લાવવા માટે વોકહાર્ટ હોસ્પિટલે બેરિઆટ્રીક સર્જરીને ઉત્તેજન આપવાની પહેલ કરી છે. આ સર્જરી માટે વોકહાર્ટ હોસ્પિટલ બધી રીતે સુસજ્જ છે. ઘણા જાડિયા લોકો માત્ર ખોરાક ઘટાડીને કે કસરત કરીને પોતાનું વજન જોઈએ તેટલા કિલો ઘટાડી શકતા નથી. આ સર્જરીથી ૧૦૦થી વધુ કિલો વજન ઘટાડી શકાય છે.



પહેલા

પછી